

B.Ed. Semester - 1 (CBCS) Examination
Jan/Feb.-2022 [NEW COURSE]
ACCOUNT(SELF STUDY COURSE)

Time: 0:45 Hours

Marks: 21

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્ર.૧ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.(૫ માંથી ૩) 03
- ૧.૧ હિસાબી પદ્ધતિ એટલે શું?
 - ૧.૨ ખાતું એટલે શું?
 - ૧.૩ વેચાણ નોંધ એટલે શું?
 - ૧.૪ રોકડમેળ નો અર્થ આપો.
 - ૧.૫ ધાલખાધ એટલે શું?
- પ્ર.૨ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.(૬ માંથી ૩) 0૬
- ૨.૧ ખાતાના ત્રણેય પ્રકાર માટે ઉધાર- જમા ના નિયમો જણાવો
 - ૨.૨ મળેલ વટાવ ઉદાહરણ સાથે સમજાવો.
 - ૨.૩ $A=C+L$ આ સમીકરણ સમજાવો.
 - ૨.૪ ખાતાવહી એટલે શું??
 - ૨.૫ કાચું સરવૈયું એટલે શું?
 - ૨.૬ કાચું સરવૈયું તૈયાર કરવાની રીતના નામ આપો.
- પ્ર.૩ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો.(૬ માંથી ૩) ૧૨
- ૩.૧ હિસાબી પદ્ધતિના હેતુઓ જણાવો.
 - ૩.૨ GST નો અર્થ આપી તેના વિશિષ્ટ લક્ષણો જણાવો.
 - ૩.૩ બેંક સિલકમેળનો નમૂનો આપો.
 - ૩.૪ પેટા નોંધના ફાયદા જણાવો.
 - ૩.૫ કાચા સરવૈયા ના કોઈપણ ચાર લક્ષણો સ્પષ્ટ કરો.
 - ૩.૬ રોકડમેળ અને પાસબુક પ્રમાણે બેન્કની બાકીમાં તફાવત આવવાના કારણો જણાવો.

ENGLISH VERSION

- Q.1 Answer the following questions in brief. (Any 3 out of 5) 03**
- (1.1) What is Accounting?.
 - (1.2) What is account?
 - (1.3) What is sales book?
 - (1.4) What is cash book?
 - (1.5) What is bad debt?
- Q.2 Answer the following questions. (Any 3 out of 6) 06**
- (2.1) Mention the rules for credit and debit the account for all three types of account.
 - (2.2) Explain discount received with example.
 - (2.3) Explain $A = C + L$.
 - (2.4) What is ledger?
 - (2.5) What is Trail balance?
 - (2.6) Name the method for preparing trial balance.
- Q.3 Answer the following questions in detail. (Any 3 out of 6) 12**
- (3.1) mention objectives of accounting.
 - (3.2) explain meaning and special features of GST.
 - (3.3) Give specimen of bank reconciliation statement.
 - (3.4) Mention advantages of subsidiary books.
 - (3.5) Explain any four characteristics of trial balance.
 - (3.6) Explain the causes of difference between bank balance as per cashbook and passbook.
